

સિટીઝન રિપોર્ટર બનો

તમારી વાર્તાઓના યોગદાન માટે અમને ઈમેઇલ કરો. writeus@deshkiaawaz.in

(નોંધ: તમારી સંપૂર્ણ માહિતી સાથે 2MB નો ફોટો ચોક્કસ મોકલો)

[Home](#) / [ગુજરાતી](#) / [રાજ્યની ખબર](#) / ડો.જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મોગરમાં આઈસેક તેમજ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ સેન્ટર ઓફ એક્સલેન્સ નું ઈ – લોચિંગ



રાજ્યની ખબર

ડો.જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મોગરમાં આઈસેક તેમજ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ સેન્ટર ઓફ એક્સલેન્સ નું ઈ – લોચિંગ

August 28, 2020



- ગુજરાતમાં સેફ ફાઇનાન્સ એન્જિનિરીંગ કૉલેજ દ્વારા કરવામાં આવેલી અભિનવ પહેલ
- ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણમાં બદલાવ તથા ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અંતર્ગત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, મશીન લર્નિંગ, અદ્યતન સોફ્ટવેર ડેવલપમેન્ટ ટેકનોલોજી વિકસાવવાનો મુખ્ય ઉદ્દેશ
- બીઝનેસ ઇક્યુબેશન જેવા ઉભરતા નવીન ક્ષેત્રો વિશે વિશેષ જ્ઞાન, ટ્રેનિંગ તથા બેન્કો દ્વારા પ્રોજેક્ટ એપ્રોઝલ અને નાણાકીય સહાયનું માર્ગદર્શન આપવાનું આયોજન
- આ પહેલ હેઠળ આત્મનિર્ભર ભારતની ધ્યેય સિદ્ધિ સહીત વિદ્યાર્થીઓને ઉત્તમ અને ઉજ્જવળ રોજગારી અને ઉદ્યોગકતા પુરી પાડવાનો તથા કારકિર્દીની ઝળહળતી તકો પ્રદાન કરવાનો છે.



આણંદ, ૨૮ ઓગસ્ટ

DJMIT કૉલેજ, મોગર ખાતે આઈસેક (આણંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટડીઝ ઇન એનર્જી એન્જિનિયરિંગ એન્ડ ક્લાઇમેટ ચેન્જ (AISECC) નું ઈ – લોચિંગ રાજ્ય સરકારના ક્લાયમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના અગ્ર સચિવ શ્રી એસ. જે.હૈદર દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે IOT Centre of Excellence (ICEM) નું ઈ – લોચિંગ સાયન્સ & ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ના સચિવ શ્રી હારિત શુક્લાએ કર્યું હતું.



આઈસેક,પર્યાવરણવિદ ડૉ. અજય દેશપાંડેના માર્ગદર્શન માં જ્યારે આઈસેમ જાણીતા ઉદ્યોગક બરોડા અંનર્જી મીટર , વિઠ્ઠલ ઉદ્યોગ નગર આણંદના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિઠ્ઠલ કામતના માર્ગદર્શનમાં કામ કરશે . ગુજરાતમાં સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિરીંગ કૉલેજ દ્વારા કરવામાં આવેલી આ આગવી અને મહત્વની પહેલ છે . આ પહેલનો મુખ્ય ઉદ્દેશ કોલેજમાં શિક્ષણ સમયાગાળામાં ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણમાં બદલાવ તથા ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અંતર્ગત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ , રોબોટિક્સ , મશીન લર્નિંગ , અધતન સોફ્ટવેર ડેવલપમેન્ટ ટેકનોલોજી , બીઝનેસ ઇક્યુબેશન જેવા ઉભરતા નવીન ક્ષેત્રો વિષે વિશેષ જ્ઞાન , ટ્રેનિંગ તથા બેન્કો દ્વારા પ્રોજેક્ટ એપ્રેઝલ અને નાણાકીય સહાયનું માર્ગદર્શન આપવા સાથે આત્મનિર્ભર ભારતની ધ્યેય સિદ્ધિ સહીત વિદ્યાર્થીઓને ઉત્તમ અને ઉજ્જવળ રોજગારી અને ઉદ્યોગકતા (Entrepreneurship) પુરી પાડવાનો તથા કારકિર્દીની ઝળહળતી તકો પ્રદાન કરવાનો છે .





આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ટેકનિકલ એક્સપર્ટ્સ તથા તમામ સ્ટાફ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી જોડાયા હતા . સંસ્થાના સંચાલક કે. એમ. સોલંકી , એકેડેમિક ડિરેક્ટર ડો .એફ .એસ.ઉમરીગર તથા કૉલેજના પ્રિન્સિપાલ ડો .બી .આર.પારેખ દ્વારા AISECC તથા ICEM ના સફળ ઇ – લોન્ચિંગ નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી છે .

સિટીઝન રિપોર્ટર બનો

તમારી વાર્તાઓના યોગદાન માટે અમને ઈમેઇલ કરો. writeus@deskhiaawaz.in

(નોંધ: તમારી સંપૂર્ણ માહિતી સાથે 2MB નો ફોટો ચોક્કસ મોકલો)



Share your reaction!  

Tags: [Anand](#), [DJMIT](#)